

નં.- રૂડા/ટેક/ડી.બી./ઝોન સર્ટીફિકેટ/પુ.વિ.ચો./૨૦૩૧/૫૧૨૦

તા. ૨૫-૧૦-૨૦૧૮

પ્રતિ

પાર્ક લેન્ડ ભાગીદારી પેઢી

C/O કુશકુમાર એન જોષી (એડવોકેટ)

આદર્શ સોસાયટી મેઈન રોડ,

રૈયા રોડની સામે, રેલ્વે ફાટક,

સુપર ટાયર અને ઝેરોક્ષની બાજુમાં,

રાજકોટ.

વિષય :- ઝોનીંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (રૂડા)ની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ અન્વયે.

સંદર્ભ :- આપશ્રીની તા. ૨૫-૧૦-૨૦૧૮ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની અરજીમાં નિર્દિષ્ટ વિસ્તાર/સાથે સામેલ નકશા મુજબ મોજે- નાનામવા તાલુકો- રાજકોટ ના રેવન્યુ સર્વે નં.- ----- અંતિમ ખંડ નં.- ૧૭૨ પ્લોટ નં.- ૭૪ ની જમીન, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૭(૧)(સી) અન્વયેના સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા નં.- જીએચ/વી/૧૯૨ ઓફ ૨૦૧૬/ડીવીપી-૧૩૨૦૧૬-૨૨૩૭૦૨-એલ, તા. ૨૭-૧૦-૨૦૧૬ થી મંજૂર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ ની અમલી દરખાસ્તો મુજબ રહેણાંક ઝોન માં સુચિત કરાયેલ છે.

સદરહુ જમીન મોજે - નાનામવા ની ટી.પી. સ્કીમ નં.- ૫ ના હદ વિસ્તારમાં આવતી હોવાથી, તેને ટી.પી. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે.

ખાસ નોંધ:-

આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે. વિકાસ/બાંધકામની પરવાનગી નથી.

A.R. Patel

જુનિયર નગર નિયોજક

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ

મુક


રાજકોટ



PART PLAN OF SECOND REVISED DEVELOPMENT PLAN 2031 A.D.

(Sanctioned under sec 17 (1) (c) of the Gujarat Town Planning & Urban Development Act.1976

Vide U.D. & U.H. Department Notification No.GH/V/192 of 2016/DVP-13-2016-223702-L,Dated 27-10-2016.



In case of Any Errors/Disputes The Record At Ruda Office Shall Be Considered Official & Shall Be Final & Binding to All.

NOTE : This part plan can not be used for making any entry in revenue records and can not be considered as Development Permission for Addition/Alteration.

ISSUED ONLY FOR

SURVEY. NO. : --

VILLAGE : NANAMAVA

TALUKA : RAJKOT

T.P.S. NO.: 05

F.P. NO.: 172



Scale : 1Cm. = 20 Mt.

LEGEND :

	FP BOUNDARY
	T.P. SCHEME ROAD
	RESIDENTIAL